

IEL LIMITED



Reg. Off. - Shed No 15, Shyam Hari Industrial Estate, Phase 4, GIDC, Vatva,
Ahmedabad - 382445, Gujarat
Tel No: 079-40026095, Website: www.ielindia.in
E-mail: iellimitedamd@gmail.com
CIN - L15140GJ1956PLC124644

24th August, 2022

To,
The Department of Corporate Service (DCS-CRD)
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai - 400 001

Ref: IEL LIMITED

SECURITY CODE NO.: 524614

SUB.: NEWSPAPER ADVERTISEMENT FOR 66TH ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION.

Dear Sir,

We are submitting herewith the copies of notices published in newspapers of Ahmedabad edition viz. Financial Express (English) and Lok Mitra (Regional language) on 24th August, 2022 confirming electronic dispatch of Notice of 66th Annual General Meeting along with the Annual Report 2021-22, Book Closure and E-voting information.

You are requested to kindly take the note of the above and display the same on the notice of the exchange.

Thanking you,

Yours faithfully,

For IEL LIMITED

Ronit Champaklal Shah
Managing Director
(DIN: 02851806)



Encl: a/a

Laffans
PETROCHEMICALS LIMITED

Regd. Office: Shed No. C1B/316 GIDC, Panoli, Ankleshwar, Gujarat - 394116
CIN: L99999GJ1992PLC018626

Corporate Office : ONE BKC, 13th Floor, 1302, B-Wing, Plot No. C-66, G-Block, Bandra Kuria Complex, Bandra (E), Mumbai-400051.
Tel.: 6693 0813/0830. Email: lplho@laffanspetrochemical.com
Website: www.laffanspetrochemicals.com

NOTICE

Notice is hereby given that the Register of Members and Share Transfer Register of the Company will remain closed from Friday September 09, 2022 to Thursday September 15, 2022 (both days inclusive) for the purpose of 29th Annual General Meeting to be held on Thursday September 15, 2022 at 10.30 a.m. at **Hotel Lords plaza, C4/6 GIDC, old national highway no.8, Ankleshwar, Gujarat 34002** to transact business as set out in the notice convening the meeting sent electronically to the shareholders of the company.

The Integrated Annual Report along with the Notice of the Meeting has been sent electronically to the Members of the company.

E-voting date and time: Monday September 12, 2022 (9.00 a.m.) to Wednesday September 14, 2022 (5.00 p.m.) IST

By order of the Board
for Laffans petrochemicals Limited
Sd/-
Mr. Sandeep Seth
Managing Director
DIN: 00316075

Place: Mumbai
Date: August 24, 2022

GLANCE FINANCE LIMITED

Register office: 7, Kitab Mahal, 192, Dr. D.N. Road, Fort, Mumbai-400001.
CIN: L65920MH1994PLC081333
Telephone No.: 022-40666675 Email: glance@glancefin.in
Website: www.glancefinance.in

NOTICE REGARDING 28th ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING

1. Notice is hereby given that the 28th Annual General Meeting ("AGM") of Members of Glance Finance Limited will be held on Tuesday, 27th September, 2022, at 05:00 P.M. IST through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM") in compliance with the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder read with circulars dated May 5, 2020 read with circulars dated April 8, 2020, April 13, 2020, January 13, 2021, December 14, 2021 and May 5, 2022 (collectively referred to as "MCA Circulars") and SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations 2015 (as amended) to transact business as contained in the notice of the 28th AGM.

2. In compliance with above mentioned Circulars, the electronic copies of the Notice of 28th AGM and the Annual Report for the financial year 2021-22 is being sent through electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories. The notice of 28th AGM and Annual Report for the financial year 2021-22 will be made available on the company's website i.e. www.glancefinance.in and can be accessed on the website of the Stock Exchange i.e. BSE Limited (www.bseindia.com).

3. Manner of registering email addresses for those Members whose email addresses are not registered for obtaining AGM Notice/Annual Report and/or for obtaining login credentials for e-voting on the resolutions set out in this Notice:
- Members holding shares in physical form are requested to consider converting their holdings to dematerialized form. Members can contact the Company or Company's Registrars and Transfer Agents, M/s. Link Intime India Private Limited ("Link Intime") for assistance in this regard.
- Members who have not yet registered their email addresses are requested to register the same with their DPs. In case the shares are held by them in electronic form and with Link Intime in case the shares are held by them in physical form.

4. Manner of casting vote through Remote e-voting (electronically):
- Members will have the facility to cast their vote on the businesses set forth in the Notice of AGM through remote e-voting system. The Company has entered into an arrangement with Link Intime India Private Limited for facilitating remote e-voting for AGM.
- Detailed procedure for casting the vote through remote e-voting during e-voting period and during the AGM shall be provided in the Notice of the AGM, which shall also be made available on the website of the Company.
- Members holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date (record date) of September 20, 2022, may cast their vote electronically. Members who have acquired shares after the dispatch of the Annual Report and before the book closure may approach the Company for issuance of the User ID and Password for exercising their right to vote by electronic means.

5. The Register of Members and Share Transfer Registers of the Company shall remain closed from September 21, 2022 to September 27, 2022 (both days inclusive) for the purpose of Annual General Meeting of the Company.

By order of the Board
For GLANCE FINANCE LIMITED
Sd/-
Narendra Karnavat
Director

Date: 23.08.2022
Place: Mumbai

JMJ FINTECH LIMITED
(formerly known as Meenakshi Enterprises Limited)
CIN: L51102TN1982PLC005711
NO. 17/9, LAKSHMIPURAM MAIN STREET, LLOYDS ROAD, ROYAPETTAH CHENNAI - 600014.
EMAIL: investor@mjmfintech.com, Website: www.mjmfintech.com

NOTICE OF THE 39TH AGM - E-VOTING AT THE AGM & BOOK CLOSURE

Notice is hereby given that the 39th Annual General Meeting ("AGM") of the Company will be held on Monday, 19th September, 2022 at 3 PM (IST), through video conference/other audio visual means in compliance with General Circular numbers 20/2020, 14/2020, 17/2020 and all other applicable laws and circulars issued by the Ministry of Corporate Affairs ("MCA"), Government of India and Securities and Exchange Board of India ("SEBI") to transact the businesses that are mentioned in the Notice of the Meeting.

In compliance with the above circulars and owing to the difficulties involved in dispatching the physical copies, kindly note that electronic copies of the Notice of the AGM and Annual Report for FY 2021-2022 will be sent to all the Members whose email addresses are registered with the Company/Depository Participant(s) within the prescribed timeline. The notice of the 39th AGM and Annual Report for FY 2021-2022 will also be made available on the Company's website, at www.mjmfintech.com, Stock Exchange websites and on the depositories' website. These documents can also be downloaded from www.mjmfintech.com as well as on the website of Bombay Stock Exchange.

Members holding shares in dematerialized mode are requested to register their email addresses and mobile numbers with their relevant depositories through their depository participants. Members holding shares in physical mode are requested to furnish their email addresses and mobile numbers with the Company's Registrar and Share Transfer Agent M/s. PurnaSharegistry (India) Private Limited (herein referred as 'RTA').

Company shall provide facility to all its Members to cast their votes on all resolutions set out in the Notice of the AGM. Additionally, the Company is providing the facility of voting through E-Voting system during the AGM. Detailed procedure is provided in the Notice of AGM.

Notice is further given that, pursuant to the provisions of Section 91 of the Companies Act, 2013, the Register of Members and Share Transfer books of the Company will remain closed from Tuesday, 13th September, 2022 to Monday, 19th September, 2022 (both days inclusive) for the purpose of Annual General Meeting of the Company.

In compliance with Regulation 44 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 and Section 108 of the Companies Act, 2013, read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Company is providing its members, facilities for remote e-voting. Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date of Monday 12th September 2022, may cast their vote electronically on the businesses set forth in the Notice of 39th AGM through the electronic voting system, from a place other than the place of venue of the AGM (remote e-voting).

All the members are informed that:

- The businesses as set forth in the Notice of 39th AGM may be transacted through e-voting.
- The remote e-voting shall commence on 16th September 2022 (9.00 a.m.).
- The remote e-voting shall end on 18th September, 2022 (5.00 p.m.).
- The cut-off date for determining the eligibility for e-voting is Monday, 12th September 2022. Any person, who acquires shares of the company and becomes member of the company after the dispatch of the Notice and holding shares as of the cut-off date i.e., Monday, 12th September, 2022 may obtain login ID and password by sending an email to investor@mjmfintech.com or with your respective Depository Participant (DP).
- If a person is already registered with remote e-voting, then existing user ID and password can be used for casting vote.
- Members holding shares in physical form who have not registered their mail addresses with the Company/Depositories may obtain the Annual Report and log in and password for E-voting providing the below necessary details:
 - For Physical Shareholders-Please provide necessary details like Folio No., Name of the shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of AADHAR card) by email to Company at investor@mjmfintech.com or to Registrar & Share Transfer Agent at purvashr@mnl.net.in
 - For Demat Shareholders-Please provide Demat account details (CDSL-16-digit beneficiary ID or NSDL-16-digit DPID + CLID), Name, Client master or copy of consolidated Account statement, PAN (Self attested scanned copy of PAN card), AADHAR (self attested scanned copy of AADHAR card) and scanned copy of PAN card by email to investor@mjmfintech.com or with your respective Depository Participant (DP).

However, if a person is already registered for e-voting then existing user ID and password can be used for casting vote.

If you have any queries or issues regarding attending AGM & E-voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdsindia.com

VI. Members eligible to vote may note that:

- The remote e-voting module shall be disabled after 5.00 p.m. on Sunday, 18th September, 2022 and once the vote on a resolution is cast by the member, the member shall not be allowed to change it subsequently.
- The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their voted again; and
- A person whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility of remote e-voting.
- If a member cast votes by both modes, then voting done through e-voting shall prevail and e-voting during the AGM shall be treated as invalid.

VII. The company has appointed Ms. Lakshmi Subramanian, Senior Partner, M/s Lakshmi Subramanian & Associates, Practising Company Secretaries, having office at 'Murugesanaiacker Complex, No.81, Greaves Road, Chennai-600006 as the scrutineer to scrutinise the e-voting process and poll at AGM in a fair and transparent manner.

VIII. The results of e-voting will be announced by the Company on its website www.mjmfintech.com and also to stock exchanges at www.bseindia.in.

By Order of the Board
For MJM Fintech Limited
Sd/-
Mr. Joju Madathumpady Johny
Managing Director
DIN : 02712125

Place: Chennai
Date: 23.08.2022

(This is only an advertisement for information purpose and is not a prospectus announcement.)

KORE **JAY JALARAM TECHNOLOGIES LIMITED**
CIN: U32202GJ2012PLC068660

Our Company was originally incorporated as "Jay Jalaram Technologies Private Limited" as a Private Limited Company under the provisions of the Companies Act, 1956 vide Certificate of Incorporation dated January 17, 2012, issued by the Registrar of Companies, Gujarat, Dadra and Nagar Haveli. Subsequently, our Company was converted into a Public Limited Company pursuant to shareholders resolution passed at Extra-ordinary General Meeting of our Company held on May 10, 2022 and the name of our Company was changed to "Jay Jalaram Technologies Limited". A fresh Certificate of Incorporation consequent upon Conversion from Private Limited Company to Public Limited Company dated May 25, 2022 was issued by the Registrar of Companies, Ahmedabad. For details of change in registered office of our Company, please refer to chapter titled "History and Corporate Matters" beginning on Page No. 115 of the Prospectus.

Registered office: Office No.103, Shail Mall, B/H. Girish Cold Drink, Ship Char Rasta, C. G. Road, Navrangpura, Ahmedabad -380009, Gujarat.
Telephone No: 079 4899 5415 • E-Mail: cs@koremobiles.com • Website: www.koremobiles.com
Company Secretary and Compliance Officer: Mr. Mukesh Dalpatram Prajapat

PROMOTERS OF THE COMPANY: MR. KAMLESH VARJIVANDAS THAKKAR, MR. KALESH HARIRAM LALWANI AND MR. MUKESHKUMAR NAVNITRAY BHATT

THE ISSUE

PUBLIC ISSUE OF 3000000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH OF JAY JALARAM TECHNOLOGIES LIMITED ("JTL" OR THE "COMPANY" OR THE "ISSUER") FOR CASH AT A PRICE OF ₹ 36 PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ 26 PER EQUITY SHARE (THE "ISSUE PRICE") AGGREGATING TO ₹ 1080.00 LAKHS ("THE ISSUE"), OF WHICH 150000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH FOR CASH AT A PRICE OF ₹ 36 PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ 26 PER EQUITY SHARE AGGREGATING TO ₹ 54.00 LAKHS WILL BE RESERVED FOR SUBSCRIPTION BY MARKET MAKER TO THE ISSUE (THE "MARKET MAKER RESERVATION PORTION"). THE ISSUE LESS THE MARKET MAKER RESERVATION PORTION I.E. NET ISSUE OF 2850000 EQUITY SHARES OF FACE VALUE OF ₹ 10 EACH AT A PRICE OF ₹ 36 PER EQUITY SHARE INCLUDING A SHARE PREMIUM OF ₹ 26 PER EQUITY SHARE AGGREGATING TO ₹ 1026.00 LAKHS IS HEREIN REFERRED TO AS THE "NET ISSUE". THE ISSUE AND THE NET ISSUE WILL CONSTITUTE 26.95% AND 25.61% RESPECTIVELY OF THE POST ISSUE PAID UP EQUITY SHARE CAPITAL OF OUR COMPANY.

THIS ISSUE IS BEING IN TERMS OF CHAPTER IX OF THE SEBI (ISSUE OF CAPITAL AND DISCLOSURE REQUIREMENTS) REGULATIONS, 2018 AS AMENDED FROM TIME TO TIME.

For further details see "Terms of the Issue" beginning on Page No. 174 of the Prospectus.

THE FACE VALUE OF THE EQUITY SHARES IS ₹ 10/- EACH AND THE ISSUE PRICE IS ₹ 36/- THE ISSUE PRICE IS 3.6 TIMES OF THE FACE VALUE.

ISSUE

Minimum Lot Size

ASBA*

UPI Mechanism

OPENS ON: FRIDAY, AUGUST 26th, 2022
CLOSES ON: TUESDAY, AUGUST 30th, 2022

3000 EQUITY SHARES FOR RETAIL INDIVIDUAL INVESTORS
6000 EQUITY SHARES AND IN MULTIPLES OF 3000 EQUITY SHARES THEREAFTER FOR HNI/QIB CATEGORY

Simple, safe, smart way to application - Make use of it.
*Application Supported by blocked amount (ASBA) is a better way of applying to issue by simply blocking the fund in the bank account, investor can avail the same. For details, check section on ASBA below.

UPI NOW AVAILABLE IN ASBA FOR RETAIL INDIVIDUAL INVESTORS.
For Details on the ASBA and UPI process, please refer to the details given in ASBA form and Abridged Prospectus and please refer to the section "Issue Procedure" beginning on page no. 181 of the Prospectus. The process is also available on the website of National Stock Exchange of India Limited (www.nseindia.com), in General Information Document. List of Banks supporting UPI is also available on the website of SEBI (www.sebi.gov.in).

IN TERMS OF THE SEBI CIRCULAR NO. CIR/CFD/POLICYCELL/11/2015, DATED NOVEMBER 10, 2015 AND THE ALL POTENTIAL INVESTORS SHALL PARTICIPATE IN THE ISSUE ONLY THROUGH AN APPLICATION SUPPORTED BY BLOCKED AMOUNT ("ASBA") PROCESS PROVIDING DETAILS ABOUT THE BANK ACCOUNT WHICH WILL BE BLOCKED BY THE SELF-CERTIFIED SYNDICATE BANKS ("SCSBS") FOR THE SAME. FURTHER PURSUANT TO SEBI CIRCULAR BEARING NO. SEBI/HO/CFD/DIL/CI/RP/2019/76 DATED JUNE 28, 2019, FOR IMPLEMENTATION OF PHASE II FOR UPI FACILITY, WHICH IS EFFECTIVE FROM JULY 01, 2019, ALL POTENTIAL BIDDERS (EXCEPT ANCHOR INVESTORS) ARE REQUIRED TO MANDATORILY UTILIZE THE APPLICATION SUPPORTED BY BLOCKED AMOUNT ("ASBA") PROCESS PROVIDING DETAILS OF THEIR RESPECTIVE ASBA ACCOUNTS OR UPI ID (IN CASE OF RUIS), IN WHICH THE CORRESPONDING APPLICATION AMOUNTS WILL BE BLOCKED BY THE SCSBS OR UNDER THE UPI MECHANISM, AS APPLICABLE. FOR DETAILS IN THIS REGARD, SPECIFIC ATTENTION IS INVITED TO "ISSUE PROCEDURE" ON PAGE NO. 181 OF THE PROSPECTUS. IN CASE OF DELAY, IF ANY IN UNBLOCKING/REFUND THE FUND, OUR COMPANY SHALL PAY INTEREST ON THE APPLICATION MONEY AT THE RATE OF 15% PER ANNUM FOR THE PERIOD OF DELAY.

Information under Section 30 of the Companies Act, 2013:
The information regarding the content of Memorandum of Association of our Company as regards Main Objects are available on page no. 116 of the Prospectus of the Company. The Liability of the Members is limited. Our Authorized Share Capital comprises of 12000000 Equity Shares of ₹ 10/- each aggregating to ₹ 1200.00 Lakh. The present issued, subscribed and paid-up share capital comprises of 8130000 Equity Shares of ₹ 10/- each aggregating to ₹ 813.00 Lakh. We are proposing to issue 3000000 Equity Shares of ₹ 10/- each in terms of the Prospectus dated August 18, 2022 at a price of ₹ 36/- per share including premium of ₹ 26/- per equity share. The Names of signatories to the Memorandum of Association of our Company at the time of Incorporation and number of shares subscribed by them is as follows:

Sr.	Name of Signatories	No. of Equity Shares subscribed No. (Face Value ₹ 10/- each)
1.	Kamlesh Hariram Lalwani	2500
2.	Varjivandas Naturam Rankagor	2500
3.	Tulsiben Varjivandas Rankagor	2500
4.	Kamlesh Varjivandas Thakkar	2500
	Total	10000

The present capital structure of the Company is as follows:

Particulars	Amount
Authorized Share Capital	₹ 1200.00 Lakh
Issued, Subscribed and Paid-up Share Capital	₹ 813.00 Lakh
Reserves and Surplus	₹ 387.00 Lakh
Total	₹ 1600.00 Lakh

LISTING

The Equity Shares offered through the Prospectus are proposed to be listed on EMERGE Platform of National Stock Exchange of India Limited ("NSE EMERGE"), in terms of the Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, as amended from time to time. Our Company has received an In-Principle Approval letter dated August 05, 2022 from National Stock Exchange of India Limited ("NSE") for using its name in this offer document for listing our shares on the EMERGE Platform of National Stock Exchange of India Limited ("NSE EMERGE"). For the purpose of this issue, the designated Stock Exchange is the NSE.

DISCLAIMER CLAUSE OF THE SECURITIES AND EXCHANGE BOARD OF INDIA

Since the Issue is being made in terms of the Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, the Offer Document had been filed with SEBI. However SEBI shall not issue any observation on the Prospectus. Hence, there is no such specific disclaimer clause of SEBI. However, investors may refer full text of the Disclaimer Clause of SEBI beginning on page no. 165 of the Prospectus.

DISCLAIMER CLAUSE OF THE NSE

It is to be distinctly understood that the permission given by NSE should not in any way be deemed or construed that the Prospectus has been cleared or approved by NSE nor does it certify the correctness or completeness of any of the contents of the Offer Document. The investors are advised to refer to the Offer Document for the full text of the "Disclaimer Clause of NSE" appearing on the page no. 166 of the Prospectus.

LEAD MANAGER TO THE ISSUE	REGISTRAR TO THE ISSUE	COMPLIANCE OFFICER
BEELINE BEELINE CAPITAL ADVISORS PRIVATE LIMITED SEBI Registration Number: INM000012917 Address: 807, Phoenix, Opp. Girish Cold Drinks, Near Vijay Cross Roads, Navrangpura, Ahmedabad -380009, Gujarat. Telephone Number: 079 4840 5357 Email Id: mb@beeline.com Investors Grievance Id: ig@beeline.com Website: www.beeline.com Contact Person: Mr. Nikhil Shah CIN: U67190GJ2020PTC114322	LINK Intime LINK INTIME INDIA PRIVATE LIMITED SEBI Registration Number: INR000004058 Address: C-101, 1st Floor, 247 Park, Lal Bahadur Shastri Marg, Vikhroli (West), Mumbai - 400 083, Maharashtra Tel. Number: 022 4918 6200 Fax: 022 4918 6195 Email Id: jitlipo@linkintime.co.in Investors Grievance Id: jitlipo@linkintime.co.in Website: www.linkintime.co.in Contact Person: Shanti Goपालkrishnan CIN: U67190MH1999PTC118368	KORE Mr. Mukesh Dalpatram Prajapat C/o. Jay Jalaram Technologies Limited Office No.103, Shail Mall, B/H. Girish Cold Drink, Ship Char Rasta, C. G. Road, Navrangpura, Ahmedabad -380009, Gujarat Telephone No.: 079 4899 5415; Website: www.koremobiles.com E-Mail: cs@koremobiles.com

CREDIT RATING: As this is an issue of Equity Shares there is no credit rating for this Issue.

DEBENTURE TRUSTEES: As this is an issue of Equity Shares, the appointment of Debenture Trustees is not required.

IPO GRADING: Since the Issue is being made in terms of Chapter IX of the SEBI (ICDR) Regulations, 2018, there is no requirement of appointing an IPO Grading agency.

BASIS OF ISSUE PRICE: The Issue Price is determined by Company in consultation with the Lead Manager. The financial data presented in section titled "Basis for Issue Price" on page no. 65 of the Prospectus are based on Company's Restated Financial Statements. Investors should also refer to the sections/chapters titled "Risk Factors" and "Restated Financial Information" on page no. 18 and 137 respectively of the Prospectus to get more informed view before making the investment decision.

RISK TO INVESTORS: Investments in equity and equity-related securities involve a degree of risk and investors should not invest any funds in this Issue unless they can afford to take the risk of losing their investment. Investors are advised to read the risk factors carefully before taking an investment decision in this offering. For taking an investment decision, investors must rely on their own examination of our Company and the Issue including the risks involved. The Equity Shares offered in the Issue have neither been recommended nor approved by Securities and Exchange Board of India nor does Securities and Exchange Board of India guarantee the accuracy or adequacy of the Prospectus. Specific attention of the investors is invited to the section titled "Risk Factors" beginning on page no. 18 of the Prospectus.

AVAILABILITY OF APPLICATION FORMS: Application Forms may be obtained from the Registered Office of our Company i.e. "Jay Jalaram Technologies Limited", the Lead Manager to the Issue i.e. "Beeline Capital Advisors Private Limited", the Registrar to the Issue i.e. "Link Intime India Private Limited". The application forms may also be downloaded from the website of National Stock Exchange of India Limited i.e. www.nseindia.com. Application supported by Block Amount forms shall be available with designated branches of Self Certified Syndicate Banks, the list of which is available at websites of the Stock Exchange and SEBI.

AVAILABILITY OF PROSPECTUS: Investors are advised to refer to the Prospectus, and the Risk Factors contained therein, before applying in the issue. Full copy of the Prospectus is available on the website of SEBI (www.sebi.gov.in), website of the issuer Company (www.koremobiles.com), the website of the Lead Manager to the Issue (www.beeline.com) and on the website of National Stock Exchange of India Limited (www.nseindia.com). Investor should note that investment in equity shares involves high degree of risk. For details, investor should refer to and rely on the prospectus, including the section titled "Risk Factor" on page no. 18 of the prospectus, which has been filed with RoC.

APPLICATIONS SUPPORTED BY BLOCKED AMOUNT (ASBA): Investors may apply through the ASBA process. ASBA can be availed by all the investors except Anchor Investors. All potential investors are mandatorily required to participate in the Issue through an Application Supported by Blocked Amount ("ASBA") process. The Investors are required to fill the ASBA form and submit the same to their Banks which, in turn will block the amount in the account as per the authority contained in ASBA Form and undertake other tasks as per the specified procedure. On allotment, amount will be unblocked and account will be debited only to the extent required to be paid for allotment of shares. Hence, there will be no need of refund. The ASBA application forms can also be downloaded from the website of National Stock Exchange of India Limited i.e. www.nseindia.com. ASBA forms can be obtained from the list of banks that is available on website of SEBI at www.sebi.gov.in and website of Stock Exchange at www.nseindia.com. For more details on ASBA process, please refer to details given in application forms and abridged prospectus and also please refer to the section "Issue Procedure" beginning on page no. 181 of the Prospectus.

Capitalized terms used herein and not specifically defined herein shall have the meaning given to such terms in the Prospectus.

BANKER TO ISSUE, REFUND BANKER AND SPONSOR BANK: AXIS BANK LIMITED Address: Matru Smriti Plot No. 326, Main Linking Road, Khar (West), Mumbai - 400052, Maharashtra, India Tel: 022-26007698 Fax: Not Available Email: khar.branchhead@axisbank.com Contact Person: Mrs. Vijaya Shetti Website: www.axisbank.com Place: Ahmedabad, Gujarat Date: August 23, 2022	On behalf of the Board of Directors For, Jay Jalaram Technologies Limited Sd/ Mr. Kamlesh Varjivandas Thakkar Chairman cum Managing Director DIN: 05132275
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------	----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

Jay Jalaram Technologies Limited is proposing, subject to market condition and other considerations, a public issue of its Equity shares and has filed the prospectus with the Registrar of Companies, Ahmedabad ("RoC"). The prospectus is available on the website of SEBI (www.sebi.gov.in), website of the Issuer Company (www.koremobiles.com), the website of the Lead Manager to the Issue (www.beeline.com) and on the website of National Stock Exchange of India Limited (www.nseindia.com). Investor should note that investment in equity shares involves high degree of risk. For details, investor should refer to and rely on the prospectus, including the section titled "Risk Factor" on page no. 18 of the prospectus, which has been filed with RoC, before making any investment decision. The equity shares have not been and will not be registered under the US Securities Act of 1933, as amended (the "securities act") and may not be offered or sold within United States (as defined in regulations under the Securities Act) except pursuant to an exemption from, or in a transaction not subject to, the registration requirement of the Securities Act. The equity shares are being offered and sold only outside the United States in offshore transaction in compliance with regulations under the Securities Act and the applicable laws of the jurisdiction where those offers and sales occurs.

GARIMA ADVT.

IEL LIMITED
Reg. Off. - Shed No 15, Shyam Hari Industrial Estate, Phase 4, GIDC, Vatva, Ahmedabad-382445, Gujarat.
Tel No: 079-40026095, Website: www.ielindia.in
E-mail: ielimitedamd@gmail.com, CIN - L15140GJ1956PLC124644

NOTICE OF THE 66th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the 66th Annual General Meeting (AGM) of the Equity Shareholders of IEL Limited ("the Company") will be held on Tuesday, 20th September, 2022 at 11:00 AM IST through Video Conferencing ("VC") or Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of the 66th AGM in compliance with the applicable provisions of the Companies Act, 2013 (Act) & Rules framed thereunder and the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 read with all applicable Circulars on the matter issued by the Ministry of Corporate Affairs ("MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI Circulars") to transact the businesses as mentioned in the 66th AGM Notice, without the physical presence of the Members at a common venue.

Pursuant to Section 101 of the Act read with Rule 18 of the Companies (Management and Administration) Rules, 2014, Regulation 36 of the Listing Regulations, Secretarial Standard on General Meetings (SS-2) and in compliance with the MCA Circulars and SEBI Circular, the Notice of 66th AGM along with the Annual Report 2021-22 have been sent on Tuesday, 23rd August, 2022 by email to those members whose email addresses are registered with the Company / Registrar and Share Transfer Agent / Depositories. The requirements of sending physical copy of the Notice of the 66th AGM and the Annual Report 2021-22 to the members have been dispensed with vide MCA Circulars and SEBI Circulars. Members are hereby informed that the said AGM Notice is also available on the Company's website www.ielindia.in, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

Pursuant to Section 106 of the Act read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, as amended from time to time, Regulation 44 of the Listing Regulations and SS-2, the Company is providing its members the e-voting facility to cast their votes on the resolution set out in the AGM Notice by using an electronic voting system from a place other than the venue of the AGM (i.e. remote e-voting). The Company will also provide a facility of e-voting to members during the AGM, who have not cast their vote by remote e-voting. The Company has entered into an arrangement with CDSL for providing the remote e-voting. A person whose name appears on the Register of Members / Beneficial Owners as on the cut-off date i.e. Tuesday, 13th September, 2022 shall only be entitled to avail the remote e-voting facility or e-voting during the AGM. The documents referred to in the Notice of the AGM are available electronically for inspection by the members from the date of circulation of the Notice of the AGM. Members seeking to inspect such documents can send an e-mail to ielimitedamd@gmail.com.

The remote e-voting period will commence on Saturday, 17th September, 2022 (09:00 AM IST) and will end on Monday, 19th September, 2022 (5:00 PM IST). During this period, the member(s) of the Company may cast their votes electronically on items mentioned in the AGM Notice. The remote e-voting shall be disabled for voting by CDSL after 05:00 p.m. IST on Monday, 19th September, 2022. Once the vote on a resolution is cast by a member, any subsequent change shall not be allowed. The voting rights of the members shall be in proportion to their shares in paid-up share capital of the Company as on the cut-off date i.e. Tuesday, 13th September, 2022. The detailed instructions relating to remote e-voting and e-voting during the AGM are provided in the Notes forming part of the 66th AGM Notice. Only those Members, who will be present in the AGM through VC / OAVM and have not cast their vote on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system available during the 66th AGM. Members who have cast their vote through remote e-voting will be eligible to attend the AGM. However, they will not be eligible to vote at the AGM.

Any person, who becomes a member of the Company after sending of the AGM Notice by email and holding shares as on Tuesday, 13th September, 2022, may refer to the AGM Notice and obtain the login ID and password from CDSL, by sending a request at ielimitedamd@gmail.com. Members whose email id is not registered, may refer "Process for those shareholders whose email addresses are not registered with the Depositories/ Company/RTA for obtaining login credentials for e-voting" as detailed in 66th AGM Notice.

In case of any queries or issues regarding remote e-voting, members may refer to the Frequently Asked Questions (FAQs) and e-voting manual available at www.evotingindia.com under help section or contact Mr. Rakesh Dalvi, Manager, CDSL, A Wing, 25th Floor, Marathon Futurex, Mafalati Mill Compounds, N. M. Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 at e-mail: helpdesk.evoting@cdsindia.com, Tel. No.: 022-23058542/43.

Pursuant to Section 91 of the Act read with Rule 10 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 42 of the Listing Regulations, the Register of Members and Share Transfer Books of the Company shall remain closed from 14th September, 2022 to 20th September, 2022 (both days inclusive) for the purpose of 66th AGM.

For IEL Limited
Sd/
Ronit Champaklal Shah
Managing Director
DIN: 02851806

Date : August 24, 2022
Place : Ahmedabad

CL
CL EDUCATE LIMITED
CIN: L74899HR1996PLC076897
Registered Office: Plot No. 9A, Sector-27A, Mathura Road, Faridabad, Haryana-121003, India
Corporate Office: A-45, First Floor, Mohan Co-operative Industrial Estate, New Delhi-110044, India
Tel.: +91 (0129) 2273242, +91 (11) 4128 1100, Fax: +91 (11) 4128 1101
Website: www.cleducate.com, E-mail: compliance@cleducate.com

NOTICE OF 26th ANNUAL GENERAL MEETING

Notice is hereby given that the Twenty-Sixth (26th) Annual General Meeting ("AGM") of CL Educate Limited ("the Company") is scheduled to be held on Thursday, September 15, 2022 at 10:00 A.M (IST) through Video Conferencing ("VC")/Other Audio Visual Means ("OAVM") facility in compliance with Circular Nos. - 14/2020 dated April 08, 2020; 17/2020 dated April 13, 2020; 20/2020 dated May 05, 2020; and 02/2022 dated May 05, 2022 issued by the Ministry of Corporate Affairs and the Securities and Exchange Board of India ("SEBI") Circulars dated May 12, 2020 and May 13, 2022 to transact the businesses as set out in the Notice convening AGM.

In compliance with the above Circulars, the electronic copies of the Notice of the AGM along with the Annual Report for the Financial Year 2021-22 have already been sent to the shareholders, whose names are appeared in the register of members as at the closing hours of business on Friday, August 19, 2022 and whose email addresses are registered with the depository participants or with the Company, or with KFin Technologies Limited, Registrar and Share Transfer Agent of the Company. The emailing of the said documents has been completed on Tuesday, August 23, 2022.

E-VOTING INFORMATION

In compliance with the provisions of Section 108 of the Companies Act, 2013 and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide its Members with the facility of remote e-voting and e-voting during the AGM through National Securities Depository Limited ("NSDL") to cast their vote on all the resolutions set forth in the Notice. The Board has appointed Mr. Sachin Sharma or failing him Mr. Dinesh Trivedi, the Designated Partners of M/s. Sharma and Trivedi LLP (LLPIN: AAW-6850), Company Secretaries, as the Scrutinizer for conducting the voting process in a fair and transparent manner. The members may note the following:

- Members holding shares as on the cut-off date i.e., Thursday, September 08, 2022 may cast their vote electronically on businesses as set out in Notice through such e-voting.
- Any person, who acquires shares and become a member of the Company after sending the Notice and holds shares as on the cut-off date may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if you are already registered with NSDL for e-voting, then you can use your existing user ID and password for casting your vote.
- The remote e-voting period will commence on Monday, September 12, 2022 at 09:00 A.M. and will end on Wednesday, September 14, 2022 at 05:00 P.M. (IST). The remote e-voting module shall be disabled by NSDL for voting thereafter. The remote e-voting shall not be allowed beyond the said date and time.
- Any person whose name is recorded in the register of members or in the register of beneficial owner maintained by the depository as on cut-off date, shall be entitled to avail the facility of remote e-voting or e-voting during the AGM.
- The members who have already cast their vote by remote e-voting, prior to the AGM can attend the meeting, but shall not be entitled to cast their votes again during the meeting.
- Members may note that the Notice of Annual General Meeting and the Annual Report for the Financial Year 2021-22 are also available on the website of the Company at www.cleducate.com, website of Stock Exchanges - BSE Limited (www.bseindia.com) and National Stock Exchange of India Limited (www.nseindia.com), and on NSDL e-voting website: www.evoting.nsdl.com.
- In case shareholders/members have any queries/grievances regarding e-voting, they may refer the Frequently Asked Questions ("FAQs") for Members and e-voting User Manual available at the download section of www.evoting.nsdl.com or call on toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at <